

## પરિપત્ર

ક્રમાંક: /મઉમશબ/સંશોધન/૨૦૧૮/૪૪૭૫ - ૦  
 ગુજરાત માધ્યમિક અને  
 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,  
 સેક્ટર-૧૦ બી, જૂના સચિવાલય પાસે,  
 ગાંધીનગર, તા. ૧૧/૧૦/૨૦૧૮

પ્રતિ,

ચિલ્લા શિક્ષણાધિકારીશ્રી (તમામ)  
 ગુજરાત રાજ્ય.

વિષય:- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે ખાનગી  
 અહેવાલના નમૂનામાં સુધારો કરવા બાબત.

સંદર્ભ:- શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: મશબ/૧૨૧૮/૧૦૪૪/૭ તા. ૨૬/૦૬/૧૦૧૮

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગના ક્રમાંક  
 ક્રમાંક: મશબ/૧૨૧૮/૧૦૪૪/૭ તા. ૨૬/૦૬/૨૦૧૮થી ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગાની  
 ૩૮(૧)(ખ)(૪)માં દર્શાવેલ નમૂના નં-૮ મદદનીશ શિક્ષકના ખાનગી અહેવાલમાં આ સાચીના  
 સામેલ પરિશીષ્ટ-૧ મુજબ સુધારો કરવામાં આવેલ છે. ઉક્ત ઠરાવની નકલ આ સાચી નાથાં  
 છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક  
 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકો માટે હાલમાં ખાનગી  
 ખાનગી અહેવાલના નમૂનાને બદલે સુધારેલ નમૂનાનો અમલ કરવાનો થાય છે. આ ખાનગી  
 આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરશો.

(બી. એન. રાજગોર)

સંયુક્ત નિયામક

ગુજરાત માધ્યમિક અને

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,  
 ગાંધીનગર.

બિડાણ: ઉપર મુજબ

નકલ સંવિનય રવાના:-

- માન. અધ્યક્ષશ્રી, ગુ.મા. અને ઉ.મા.શી. બોર્ડ, ગાંધીનગર.
- ખાસ ફરજ પરના અધિકારીશ્રી, ગુ.મા. અને ઉ.મા.શી. બોર્ડ, વડોદરા.

નકલ રવાના:-

- સચિવશ્રી, ગુ.મા. અને ઉ.મા.શી. બોર્ડ, ગાંધીનગર.
- પરીક્ષા સચિવશ્રી(વિ.પ્ર., સા.પ્ર.), ગુ.મા. અને ઉ.મા.શી. બોર્ડ, ગાંધીનગર.
- પરીક્ષા સચિવશ્રી(SSC), ગુ.મા. અને ઉ.મા.શી. બોર્ડ, વડોદરા.

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયોગ ૩૮ /૧  
 (૪) (૫)ના નમૂના-C માધ્યમિક ઉપયોગ  
 માધ્યમિક શાળાઓમાં શિક્ષકી મટે ખાનગી  
 અહેવાલમાં સુધારો કરવા બાબત

ગુજરાત સરકાર

ରିକ୍ଷତା ବିଭାଗ

નાય કમ્પાંડ: પણા/૧૨૧૮/૧૦૫૪/૭

સચિવાલય, ગાંધીનગર

ता.१८/०९/२०१८

### વચ્ચાને લીધા:-

(૧) ગુજરાત માટ્યેમણ અને ઉચ્ચતર માટ્યેપિક રિલાફ બોર્ડ, ગાંધીનગરની સીગલ ફાઇલ પરિણામ  
તારીખ/૦૮/૨૦૧૮ની નોંધ

આભાસ-

ઉપર્યુક્ત વચ્ચે લીધેલા સંદર્ભ-(૧) ની નોંધથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બીજી માન્યતા પરાવતી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કર્ણ બજાવતા મદદનીશ શિક્ષકો માટે ખાલી અહેવાલના નમૂના સુધીરવા માટે સિંગલ ફાઇલ અંગે મળેલ રજૂઆત પરત્વે નીચે મુજબ હરાવવામાં આવે છે

६२४

પુષ્ટ વિચારણાને અતે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ-૧૯૭૪ના વિનિયમ-૩૮(૧)(ખ)(૫)માં કહોતું નમુના નં-૮ મદ્દનીશ શિક્ષકનો ખાનગી અહેવાલમાં આ સાથેના સામેલ પરિશિષ્ટ-૧ મુજબ સુધીના આદી ક્ષાંકવામાં ચારે છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક / ઉત્ક્ષેપ માધ્યમિક શાણાંશેમાં લલમાં અમલી ખાનગી અહેવાલના નમુનાને બદલે ખાનગી અહેવાલનો સુધીરેલ નમુનો આપવો જરૂરી હતો.

૨. આ હૃદમો સરકારશીની ૧૮/૨૫/૦૬/૨૦૧૪ ક્રમાંગનોથી સળેલા અનુસ્વારીય ખાત્ર પાડવામાં આવે છે.

ગુજરાતના રાષ્ટ્રીયપાલકશીખાના કાનૂનો, લિબેલ્સ અને વાર્ષિક-PR

~~check~~  
2/10/10  
✓  
6/10

~~DEAN'~~

(अंग्रेजी)

બાયબ સરિએ,

ରିକ୍ଷତା ବିଭାଗ

48

-पान. भंत्रीशी (किल्ला) ना. अंगल सचिवशी, स्वर्णिम भुजल -१, सचिवालय, गांधीनगर.

-અગ્ર સચિવશ્રી (શિક્ષણ) ના રહસ્ય સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.

માધ્યલક્ષી ગજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.

નિયામકશી આગામીની કચેરી, ડૉ. જુવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

-ચિહ્ના વિસ્તારપદ્ધતિશી રમામ (લિયામકશી શાળાઓની કાર્યક્રમ)

એવાં માટે કરીને કા-ચ-ચ કા-ચ આપા બિલ્લ વિલ્લ અંડીલગ

ପ୍ରକାଶନ ମଧ୍ୟାମ୍ଭାବୀ ଏବଂ ବିଜ୍ଞାନ ବିଷୟରେ ଅନ୍ତର୍ଦ୍ଦୟରେ

મદદનીશ શિક્ષકનો ખાનગી અહેવાલ

તા...../...../..... થી તા...../...../..... વર્ષ.....

પગાર ધોરણ: ..... ગ્રેડ પે: ..... ઈન્ફીરેન્ટ: ..... ઈન્ફી. તા. ..../..../....

૧. શિક્ષકનું નામ : .....

૨. શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતો : શૈક્ષણિક : ..... વ્યવસિક : .....

૩. આ શાળામાં જોડાયા તારીખ : તા...../...../..... વર્ષ : .....

૪. શિક્ષક તરીકેનો કુલ અનુભવ : વર્ષ : ..... માસ : .....

૫. કયા કયા વિષયો કયા ધોરણોમાં : વિષય : ..... ધોરણ : .....  
શીખવે છે?

૬. શીખવતા વિષયમાં શિક્ષકનું ઉડાણ : .....

૭. વિષયના ઉડાણ માટે ઠતર વાચન :  
સંદર્ભ સાહિત્યની રૂચિ અને વાચન  
(વર્ષમાં ડેટલાં પુસ્તક વાંચ્યાં ?)

૮. વર્ગ-શિક્ષણ - કાર્યની અસરકારકતા :

- ❖ વિધાર્થીઓને શિક્ષકના કામથી પૂરો સંતોષ છે? :
- ❖ શીખવેલું વિધાર્થીઓ સારી રીતે ગૃહણ કરી શકે છે? :
- ❖ ક્રોશાલ્ય વિકાસમાં શિક્ષકની અસરકારકતા :
- ❖ વિધાર્થીઓમાં સ્વ-અધ્યયનની ટેવ પડે તેવા પ્રયાસો કરે છે? :
- ❖ એમાં સફળતા મળી છે? :
- ❖ શૈક્ષણિક સાધનો, દુષ્ય-ગ્રાવ્ય સાધનોનો શિક્ષણકાર્ય વખતે  
ઉચ્ચિત ઉપયોગ કરે છે? :
- ❖ એમના વિષયનું પરિણામ કેવું છે? (ઉત્તમ, મધ્યમ, નિયમિત) :

e. શિક્ષણમાં નવીનીકરણને આવકારે છે ?

- ❖ નવી પદ્ધતિઓ, નવી પ્રવિધિઓ પ્રયોજે છે ?
- ❖ પ્રોગ્રામીલતાને સ્થાન આપે છે ?
- ❖ વર્ષ દરમ્યાન એવા કોઇ વિશેષ સંશોધન, અભ્યાસ, પ્રોજેક્ટ સર્વેક્ષણ વગેરે હાથ ધર્યા છે ?  
(વિગતો આપવી)

૧૦. વિધાયીઓને શૈક્ષણિક પ્રક્રિયામાં સહભાગી બનાવવામાં

અસરકારતા

- ❖ શૈક્ષણિક પ્રવૃત્તિમાં
- ❖ અભ્યાસ પ્રક પ્રવત્તિઓમાં
- ❖ સામાજિક પ્રવૃત્તિઓમાં
- ❖ રચનાત્મક પ્રવૃત્તિઓમાં
- ❖ સર્જનાત્મક પ્રવૃત્તિમાં

૧૧. શિક્ષકના વ્યક્તિગત અને સામાજિક ગુણ

- ❖ સામાજિક ગુણો
- ❖ સહકારની ભાવના
- ❖ સામાજિક પ્રવત્તિઓમાં અગ્રસરતા
- ❖ સહકાર્યકરો સાથે સુમેળ
- ❖ સહયોગ

૧૨. વિધાયીઓના વિકાસની પ્રક્રિયામાં સામેલગીરી

- ❖ શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગેદરીન
- ❖ સુટેવોના ઘડતરમાં ફાળો
- ❖ સ્વચ્છતા અને આરોગ્ય
- ❖ તેજસ્વી અને નબળા વિધાયીઓના વિકાસમાં ફાળો
- ❖ નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણમાં રસ અને કામગીરી
- ❖ મનોવૈજ્ઞાનિક કસોટીઓ
- ❖ વિધાયીઓની ખામીઓ, નબળાઇઓ દ્વારા કરવા કરેલા પ્રથાસો
- ❖ વાતી સંપર્ક
- ❖ વિધાયીઓની માનસિક સમસ્યાઓ અને મુંગવણોમાં અદા કરેલો ફાળો

### ૧૩. જવાબદારીની ભાવના

- ❖ જવાબદારી હૃદયપૂર્વક સ્વીકારે છે? :
  - ❖ સોપેલું કામ નિષ્ઠાપૂર્વક બજાવે છે? :
  - ❖ કામગીરીને પરિણામલક્ષી કેટલે અશે બનાવે છે? :
  - ❖ વાંધાવચક ઉલ્લા કરવાની ટેવ છે? :
  - ❖ સ્વેચ્છાએ સોપાતી કામગીરી સ્વીકારવાની તત્પરતા બતાવે છે? :
  - ❖ અમલમાં સહિય છે કે ઉદાસીન? :
  - ❖ કામમાં પ્રતિબધ્યતા છે? :
  - ❖ ક્ષમતાપૂર્વક અને અસરકારક રીતે કામગીરી બજાવે છે? :

૧૪. રમતગમતો, સાંસ્કૃતિક પ્રવર્તિઓ, સામાજિક, પ્રવર્તિઓ તથા અન્ય પ્રવર્તિઓમાં સામેલગીરી (વિગતો જીવાચા)

- ❖ રમતામત
  - ❖ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
  - ❖ સામાજિક પ્રવૃત્તિઓ
  - ❖ અભ્યાસ પ્રવૃત્તિઓ

૧૫. જીવનમાં કોઈ આડશો, સિધ્યાતોનું પાલન કરે છે? કુચા?

૧૬. વર્ષે દરમિયાન વ્યવસાયિક સહજતામાં વૃધ્ય થઈ છે? કિ બાબતમાં?

- ❖ (વિશેષ લાયકાતો, સિદ્ધિઓ, તાલીમ વગેમાં હાજરી, પુસ્તક પ્રકાશન લેખો પ્રગટ થવા વગેરે)

## ૧૩. એકદરે વ્યક્તિત્વ (પ્રભાવશાળી, મધ્યમ, સાધારણ)

## ૧૮. શીલ અને ચારિત્યના ગુણો (સદાચાર, સત્કાર્ય, વ્યસનમુજિત્ત)

૧૦. વર્ષ દરમિયાન તેમણે કોઇ વિશીષિત/નોંધપાત્ર કામગીરી બજાવી છે? (વિગત આપવી)

૨૦. શિક્ષકનું એકદર મૂલ્યાંકન  
(ઉત્તમ, ધ્યાન સારું, સારું, મધ્યમ, નિબધું)

આચાર્યની સત્રી

संचालन.....

संग्रहीत

તारीخ:...../...../.....

ହିନ୍ଦୀ: